

SEAT No. _____

No. of Printed Pages : 4

[127/A39]
E+G

SARDAR PATEL UNIVERSITY

B.Com (Semester V) Examination

Monday, 18th November, 2019

02:00 pm to 04:00 pm

UB05CCOM10: Financial Management

Total Marks: 60

Note: Figures to the right indicate full marks of the question.

Q-1 (a) What is Financial Management? Discuss in detail Managerial Functions and Routine Functions of Financial Management. (15)

OR

Q-1 (a) Explain the importance of Financial Management. (08)

(b) Explain the role of Finance Manager. (07)

Q-2 What is Over-Capitalization? Discuss causes, effects and remedies of Over-Capitalization. (15)

OR

Q-2 (a) What is Financial Planning? Explain the Characteristics of Financial Planning. (08)

(b) Discuss the factors affecting financial planning. (07)

Q-3 Explain the following sources as a long term source of finance: (15)

(a) Equity Share (b) Debenture

OR

Q-3 Explain the following sources of finance: (15)

(a) Commercial Banks (b) Foreign Capital (c) Public Deposits

Q-4 (a) What is Capital Budgeting? Explain the characteristics of Capital Budgeting. (08)

(b) Describe the steps in the process of Capital Budgeting. (07)

(1)

(P.T.O.)

OR

Q-4 A company is considering the following two projects A and B. (15)

The following details are available :

Particulars	Project A	Project B
Investment (Rs.)	4,40,000	5,50,000
Salvage Value (Rs.)	40,000	50,000
Expected Life	4 Years	5 Years
Method of Depreciation	Straight Line	Straight Line
Cost of Capital	10%	10%
Income tax rate	50%	50%

Earnings before depreciation and tax:

	Rs.	Rs.
1 st Year	1,20,000	1,40,000
2 nd Year	1,40,000	1,60,000
3 rd Year	1,60,000	1,80,000
4 th Year	2,20,000	2,20,000
5 th Year	-	2,00,000

Which project should be selected by the company? Assist the company to take a decision by using the following methods:

- Pay-Back Period
- Average Rate of Return
- Net Present Value (at 10% rate of discount)

Year	1	2	3	4	5
Present Value of Rs.1 @10%	0.909	0.826	0.751	0.683	0.621

(2)

SEAT No. _____

No. of Printed Pages : 4

[127/A39]
E+G

SARDAR PATEL UNIVERSITY

B.Com (Semester V) Examination

Monday, 18th November, 2019

02:00 pm to 04:00 pm

UB05CCOM10: Financial Management

Total Marks: 60

નોંધ: જમણી બાજુના આંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

પ્ર-૧ નાણાંકીય સંચાલન એટલે શું? નાણાંકીય સંચાલનના સંચાલકીય કાર્યો અને રૂઢિગત કાર્યોની (૧૫)
વિગતે ચર્ચા કરો.

અથવા

પ્ર-૧ (અ) નાણાંકીય સંચાલનનું મહત્ત્વ સમજાવો. (૦૮)

(બ) નાણાંકીય સંચાલકની ભૂમિકા સમજાવો. (૦૭)

પ્ર-૨ અતિ-મૂડીકરણ એટલે શું? અતિ-મૂડીકરણના કારણો, અસરો અને ઉપાયોની ચર્ચા કરો. (૧૫)

અથવા

પ્ર-૨ (અ) નાણાંકીય આયોજન એટલે શું? નાણાંકીય આયોજનના લક્ષણો સમજાવો. (૦૮)

(બ) નાણાંકીય આયોજનને અસર કરતાં પરિબલોની ચર્ચા કરો. (૦૭)

પ્ર-૩ લાંબા ગાળાના નાણાં પ્રાપ્તિના સાધન તરીકેના નીચેના સ્ત્રોતો સમજાવો: (૧૫)

(અ) ઇક્વિટી શેર (બ) ડિબેનચર

અથવા

પ્ર-૩ નાણાં પ્રાપ્તિના નીચેના સ્ત્રોતો સમજાવો: (૧૫)

(અ) વ્યાપારીબેંકો (બ) વિદેશી મૂડી (૩) જાહેર થાપણો

પ્ર-૪ (અ) મૂડી અંદાજપત્ર એટલે શું? મૂડી અંદાજપત્રના લક્ષણો સમજાવો. (૦૮)

(બ) મૂડી અંદાજપત્રની પ્રક્રિયાના તબક્કાઓનું વર્ણન કરો. (૦૭)

(3)

(P.T.O.)

અથવા

પ્ર-૪ એક કંપનીને નીચેની બે યોજનાઓ 'અ' અને 'બ' વિચારણા હેઠળ છે.

(૧૫)

નીચેની વિગતો પ્રાપ્ત થયેલી છે:

વિગત	યોજના-અ	યોજના - બ
મૂડી રોકાણ (રૂ.)	૪,૪૦,૦૦૦	૫,૫૦,૦૦૦
ભંગાર કિંમત (રૂ.)	૪૦,૦૦૦	૫૦,૦૦૦
અંદાજી આયુષ્ય	૪ વર્ષ	૫ વર્ષ
ઘસારાની પદ્ધતિ	સીધી લીટીની પદ્ધતિ	સીધી લીટીની પદ્ધતિ
મૂડી પડતરનો દર	૧૦%	૧૦%
આવકવેરાનો દર	૫૦%	૫૦%

ઘસારો અને કરવેરા પહેલાંની કમાણી

	રૂ.	રૂ.
૧લું વર્ષ	૧,૨૦,૦૦૦	૧,૪૦,૦૦૦
૨જું વર્ષ	૧,૪૦,૦૦૦	૧,૬૦,૦૦૦
૩જું વર્ષ	૧,૬૦,૦૦૦	૧,૮૦,૦૦૦
૪થું વર્ષ	૨,૨૦,૦૦૦	૨,૨૦,૦૦૦
૫મું વર્ષ	-	૨,૦૦,૦૦૦

કંપનીએ કઈ યોજનાની પસંદગી કરવી જોઈએ? નીચેની પદ્ધતિઓને આધારે કંપનીને યોગ્ય નિર્ણય માટે મદદ કરો:

- પરત-આધુનિક મુદત પદ્ધતિ
- સરેરાશ વળતરના દરની પદ્ધતિ
- ચોખ્ખું વર્તમાન મૂલ્ય (૧૦% વટાવના દરે)

વર્ષ	૧	૨	૩	૪	૫
૧૦%ના દરે રૂ. ૧નું વર્તમાન મૂલ્ય	૦.૮૦૮	૦.૮૨૬	૦.૭૫૧	૦.૬૮૩	૦.૬૨૧

— X —
(4)